



પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય



આણંદ કૃષિ યુનિવર્સિટી,

આણંદ- ૩૮૮૦૦૧

પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ ખાતે "આપદા સમયે જાનવરોની સુરક્ષા અને પ્રબંધન" વિષય પર ચાર દિવસીય વર્કશોપનું આયોજન

આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન પશુચિકિત્સા અને મહાવિદ્યાલય ખાતે તા.૦૯/૧૦/૨૦૧૯ "વેટરનરી ઈમરજન્સી રીસ્પોન્સ યુનિટ" (VERU) દ્વારા 'આપદાના સમયે જાનવરોની સુરક્ષા અને પ્રબંધન' વિષય પરનો વર્કશોપ સ્નાતક કક્ષાનાં છેલ્લા વર્ષમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આરંભાયો હતો. આ વર્કશોપના ઉદ્ઘાટન પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી, ડૉ. આર. વી. વ્યાસે જાનવરો તેમજ પશુપક્ષીઓની જાળવણી અંગે સુચનો કર્યા હતા. આપદાના સમયે પશુઓની સુરક્ષા અને પ્રબંધન કરવું, તેમજ સારસંભાળ લેવી એ ઉમદા કર્તવ્ય છે તેમ જણાવ્યું હતું. તેમના મંતવ્ય મુજબ આપદાના સમયે જીવમાત્રનો બચાવ કરવો, જેમા મનુષ્ય સાથે પશુપક્ષીઓને પણ સાંકળી લેવા તે ખરેખર બિરદાવવા લાયક છે તેમ જણાવ્યું હતું.

અતિથી વિશેષશ્રી પદેથી બોલતા ગુજરાત રાજ્યના પશુપાલન નિયામકશ્રી, ડૉ. ફાલ્ગુનીબેન ઠાકર દ્વારા પશુપાલન વિભાગ કેવી રીતે આપદાના સમયે જાનમાલની સુરક્ષા સાથે પશુપક્ષીઓની પણ બચાવ કાર્યની દેખભાળ લે છે તે અંગેની સચોટ માહિતી આપેલ હતી. અતિથી વિશેષ નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ, ડૉ. ડી. એસ. પટેલે વિદ્યાર્થીઓને મળતી આપદા સમયનાં રાહત કાર્યની તાલીમ અને વિદ્યાર્થીકાળથી જ તેઓની સામાજિક જવાબદારીઓના મુડીરૂપ આ વર્કશોપને બિરદાવ્યો હતો. ગુજરાત ખાતેની છઠ્ઠા NDRF બટાલીયનના આસી. કમાન્ડર, શ્રી. આર. કે. મિશ્રા એ આપદા સમયે NDRF કેવી રીતે કામગીરી કરે છે તેમજ પશુપક્ષીના જીવની સારસંભાળ કેવી રીતે કરી શકાય તે અંગે વેટરનરી કોલેજ આણંદ દ્વારા NDRF ને તાલીમ તેમજ માર્ગદર્શન પુરુ પાડે છે તે બદલ ધન્યતા વ્યક્ત કરી હતી.

ઉદ્ઘાટન પ્રસંગે મહાવિદ્યાલયના ડીનશ્રી ડૉ. એમ. એન. બ્રહ્મભટ્ટ દ્વારા સૌ મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ એવં સ્મૃતિચિન્હથી કરવામાં આવ્યું હતું તેમજ મહાવિદ્યાલયની કામગીરી અંગે પરિચય આપવામાં આવ્યો હતો. આ વર્કશોપના ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી, ડૉ. આર. એસ. જોષીએ વર્કશોપ દરમિયાનની કામગીરી તેમજ ઉદ્દેશ્યની વિગતવાર માહિતી આપી હતી. આણંદ નગરપાલિકાના સહયોગથી આ પ્રસંગે ફાયર ઓફિસર, શ્રી. ધર્મેશ ગોર દ્વારા મોકડીલ (નિદર્શન) નું આયોજન કરેલ તેમજ આગજનીના પ્રસંગે આગ બુજાવવા અંગેનું નિદર્શન કરેલ હતું. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. એસ. કે. રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ VERU ના ટ્રેનર ડૉ. આર. જે. મોદી તેમજ ડૉ. કે. એ. સાદરીયા દ્વારા વર્કશોપ અંગેની સમગ્ર કામગીરી સુંદર રીતે બજાવવામાં આવી હતી.



પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, આકૃત્યુ, આણંદ ખાતે "આપદા સમયે જાનવરોની સુરક્ષા અને પ્રબંધન" વિષય પર વર્કશોપનું આયોજન